

BUSINESS મિત્ર Plus

વૈશ્વિક સંઘર્ષો અને મેક્રો-ઇકોનોમિક અનિશ્ચિતતાથી સોના-ચાંદીના ભાવને ટેકો મળતો રહેશે

સો નુ અને ચાંદી લાંબા સમયથી કિમ્તી ધાતુઓ તરીકે જાણીતી છે. આ બંને ધાતુઓ મુખ્યત્વે ઘરેણાઓ બનાવવામાં વપરાય છે અને તેમના ઔદ્યોગિક સંદર્ભમાં પણ કેટલાક ઉપયોગો છે. આ ધાતુઓ સેંકડો વર્ષથી માણસખતને આકર્ષતી આવી છે. અને સોનાના એક સાદા તરીકે પણ આ બંને ધાતુઓ, ખાસ કરીને સોનું એક પ્રતિષ્ઠા ધરાવે છે. ખાસ કરીને મુશ્કેલીના સમય માટે સોનાનો સંગ્રહ કરી રાખવો એ માણસની વૃત્તિ રહી છે અને આ સેફ હેવન સોનાની ભાવનાથી પ્રેરાઈને જ હાલમાં પણ આ ધાતુઓમાં ખરીદી વધી છે. તાજેતરના કોમોડિટી આઉટલુક રિપોર્ટ્સ અનુસાર, ચુદ્ધ અને મેક્રો-ઇકોનોમિક અનિશ્ચિતતા સોના અને ચાંદીના ભાવને ટેકો આપવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે, પરંતુ ટૂંકા ગાળાની વોલેટિલિટી (ભાવમાં વધ-ઘટ) ઊંચી રહી શકે છે. ટાટા એસેટ મેનેજમેન્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને માર્ચ 2026 માટેના



કુગાવાનું દબાવ વધારી શકે છે. ICICI ડાયરેક્ટ વલ્યુમાં જણાવ્યું હતું કે ટેરિફ સંબંધિત સતત અસ્થિરતા અને વેપાર નીતિની અનિશ્ચિતતા નાણાકીય બજારોને અસ્થિર રાખી શકે છે - એક એવી સ્થિતિ જે ઐતિહાસિક રીતે સોના જેવી સુરક્ષિત સંપત્તિની માંગને ટેકો આપે છે.

સોનાને ટેકો આપતા માળખાગત પરિવર્તનો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે સોનાની માંગ માટેના મુખ્ય માળખાગત પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો છે: પ્રથમ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ

કોમોડિટી વોચ

આઈસીઆઈસીઆઈ (ICICI) ડાયરેક્ટ માસિક કોમોડિટી આઉટલુકના ડેટાને ટાંકીને જણાવ્યું છે કે, સોનાના કિંમતી ધાતુઓમાં એકસાથે મોટી ટકમનું સોનાના કિંમતને બદલે ધીમે-ધીમે સોનાના કિંમતને વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે. સોનાના કિંમતી ધાતુઓમાં તાજેતરની અસ્થિરતા માટે મુખ્યત્વે વધતા ભૌગોલિક રાજકીય જોખમો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને જવાબદાર માને છે. પશ્ચિમ એશિયામાં તણાવ અને મુખ્ય વેપાર માર્ગોમાં અવરોધો વધવા સાથે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ICICI ડાયરેક્ટના કોમોડિટી આઉટલુક મુજબ, ઈરાન અને અમેરિકા-ઈરાનના ગઠબંધન વચ્ચેનું ચુદ્ધ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા લંબાવી શકે છે. સ્પોર્ટ્સમાં જણાવવાનું છે કે ઉર્ષ પુરવઠા સૂચનામાં અવરોધ અને તેલના ઊંચા ભાવ અનેક દેશોમાં

તાજેતરના કોમોડિટી આઉટલુક રિપોર્ટ્સ અનુસાર, ચુદ્ધ અને મેક્રો-ઇકોનોમિક અનિશ્ચિતતા સોના અને ચાંદીના ભાવને ટેકો આપવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે, પરંતુ ટૂંકા ગાળાની વોલેટિલિટી ઊંચી રહી શકે છે

છેલ્લા દાયકામાં તેમની સોનાની ખરીદી લગભગ બમણી કરી છે કારણ કે તેઓ કરચ્છીને બદલે અન્ય અનામતોમાં વિવિધતા લાવી રહી છે. બીજું, વધતી જતી રાજકીય ખાધ અને ચાલુ ડી-ડોલરઇજીઓના વલણો નાણાકીય હેજ તરીકે સોનાના આકર્ષણમાં વધારો કરી રહ્યા છે. ત્રીજું, ધાતુનો મર્યાદિત નવો પુરવઠો લાંબા ગાળે ભાવને ટેકો આપવાનું ચાલુ રાખે છે. સંશોધનમાં એ પણ નોંધવમાં આવ્યું છે કે ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં સોનાના કિંમતોનો રસ સતત જળવાઈ રહ્યો છે.

ચાંદીની ઔદ્યોગિક માંગ
ચાંદીનું આઉટલુક પણ એટલા જ મજબૂત પરિવર્તન દ્વારા સમર્થિત છે. ICICI ડાયરેક્ટના અહેવાલ

ગલ્ફવોર વફરતા ઓઈલ, ખાતર, ફિડસ્ટોકમાં સ્ફોટક તેજ : શેરબજાર-રૂપિયો તૂટ્યા

અમેરિકા-ઈરાનના વચ્ચેનું ચુદ્ધ ધીમે ધીમે બહુપ્રકારીય સંઘર્ષમાં પલટાઈ કુદ ઓઈલ, ગેસ, નેપ્થા, પ્લાસ્ટીક, પીવીસી, ખાતર, ખાદ્યતેલ, મિથાનોલ, ડિઝલ જેવી સંખ્યાબંધ કોમોડિટીમાં આગરતી તેજ થઈ છે અને એની સીધી અસર શેરબજાર તેમજ રૂપિયામાં કડાકા રૂપે જોવાઈ છે. ભારત કુદ, નેચરલ ગેસ, ખાતર, મિથાનોલ, પીવીસી જેવા ફિડસ્ટોક અને એનર્જી-કુદ-ઔદ્યોગિક ઇકોનોમી માટે ફક્ત વ્યૂહાત્મક રીતે મહત્વની કોમોડિટી પર ગલ્ફ અને હોરમુઝ શિપિંગ રુટ પર નોંધપાત્ર આધાર રાખતુ હોવાથી ઈરાન સંકટ ભારત માટે ચિંતાનો વિષય છે. શેરબજારમાં ઘણીકુટ વેચવાલી છે. રૂપિયો 92.48ની વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો છે. બેન્ક ડ્રુના ભાવ ત્રણ માસમાં 70 ડોલરથી ઉછળી 120 ડોલર થઈ હવે 103 ડોલર આસપાસ પહોંચ્યા છે. આ લખાણે ત્યારે શનિવારે ચુદ્ધ 15મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાને તેલ પરિવહન અને જહાજ પરિવહન, મહત્વના જળમાર્ગો, સિદ્ધાન્ટરીઓ, ગેસ સ્ટોરેજ જેવી ફેક્ટોરીઓ પર હુમલા કરતા મધ્યપૂર્વમાં તનાવ વડ્યો છે. અમેરિકાએ ઈરાનની મહત્વની ઓઈલ લોડિંગ ફેક્ટોરીની ખર્ગ ટાપુ જમ કરવા સૈન્ય તહેનાત કર્યું છે. ઈરાને આ મામલે આકરૂં રોલવણી આપી છે. હાલમાં હોરમુઝમાં ટેન્કરોની મોટી લાઇન લાગી છે વિશ્વનું 20



ટકા કુદ અન ભારત આવતુ 35-40 ટકા કુદ તેમજ નેપ્થા, મિથાનોલ જેવા મહત્વના રસાયણ હોરમુઝ થી આવે છે. સાથેસાથ ઈરાનના પ્રોક્ષી સહયોગી હુથી બજાવખોરોએ હોરમુઝ જેવો જ મહત્વનો ટેડ સી પાસે આવેલો કોરિડોર બાબ અલ મદેન પણ હુમલા કરીને ખોરવવાની ચીમકી આપી છે.

બિરેન વકીલ

આ કોરિડોર નજીક ઈરીટીયાઈ-ઈથિયોપીયા વચ્ચે જંગ છેડાય તો ટેડસી-સુદાન નજીકનો આ મહત્વનો કોરિડોર પરિવહન માટે મોટો પડકાર બની શકે એમ છે. પશ્ચિમી દેશોએ તેલની તેજી રોકવા 40 કરોડ ડોલર ઓઈલ રિઝર્વમાંથી છુટું કરવાનું કહેતા બેન્ક એક તબક્કે 80 ડોલર નીચે ગયા પછી ફરી 103 થઈ ગયું છે. એકાદ વીકમાં ચુદ્ધવિરામ કે સમજૂતી ન થાય અને નવા મોરચાઓ પૂલે તો કુદ 120-150 ડોલર સુધી જાય તો એનર્જી-ખાતર-કુદ કટોકટીનો ત્રેવડો ખતરો સર્જાય.

બજારોની વાત કરીએ તો કુદ અને પીવીસી- નેપ્થા, ઈથીલીન ગ્લાયકોલ જેવા

વધ્યા છે જે કુગાવો, મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદન માટે સારા સમાચાર નથી. ગ્લોબલી વિમાનોના ઈંધણ, ડિઝલ, પેટ્રોલમાં અછતની ભીતિ અને બેકાબુ તેજીથી એવીએશન, પ્રવાસન, હોટેલ વગેરે સેક્ટરો થરથરે છે. એમસીએક્સ કુદના ભાવ એક માસમાં 6500થી વધી 10500 થઈ 9800 બંધ હતા. પીવીસી, પ્લાસ્ટિક જેવા ઘણી આયાતી આઈટેમમાં વિદેશી સપ્લાયરો ફોર્સ મેજર કહીને શિપમેન્ટમાં ડિફોલ્ટ થયા છે. એઝીકોમોડિટીની વાત કરવી જરૂરી છે કેમ કે વૈશ્વિક પરિવહન- ખાતરની કટોકટી સપ્લાય ચેઇન ડિસરચાનમાં

પોટાશ, યુરિયા, એમોનિયા, નાઇટ્રોજન ખાતરમાં સપ્લાય સાઇડ સિક્યોરીટી જરૂરી હોવાને કારણે ઈબદમાં સોનું 25-30 ડોલર ડિસ્કાઉન્ટમાં કવોટ થાય છે. ડોલરની તેજી, શેરબજારની મંદી-કુડની અફડાતફડી, માર્જિન કોલ જેવા કારણો પણ કામચલાઉ મંદીકારક ગણાય. સોનું હાલ 4800-5300 ડોલર, લોકલ સોનું 155000-163000ની રેન્જમાં, ચાંદી 2.50-2.90 અને લંડન ચાંદી 75-95 ડોલરની રેન્જમાં અથડાય છે. મેટલ્સમાં ઉછાળે વેચવાલી છે. કોમોડિટીની તેજી, ઔદ્યોગિક મંદીને કારણે સ્ટેગફ્લેશન-મંદીવચ્ચે કુગાવાનો ખતરો છે. ઈબદ રીઅલ એસ્ટેટ અને એનર્જી ક્રાઇસીસ, અમેરિકામાં પ્રાઇવેટ ક્રેડિટ-બેન્ક, એઆઇ શેરોમાં ગાબડા પણ વોચ કરવા જેવી વાત છે.

ખાતર કટોકટી- અલ નીનો- શિપિંગ ડિસરચાનથી મોંઘવારી વધવાની ભીતિ- જમાખોરી રોકવા સરકાર હસ્તમાં

માટે મંજૂરી આપી છે, રશિયા પાસેથી ત્રણ કરોડ બેરલ કુદ ખરીદવાના સમાચાર મળે છે. ગલ્ફ ક્રાઇસીસને કારણે શેરબજારમાં ઘણીકુટ વેચવાલી આવી છે. માર્કેટ કેપ અંદાજે 500 કરોડ ઘટી ગયું છે. રૂપિયો 92.48 થઈ ગયો છે. ડોલર ઈન્ડેક્સ ઉછળ્યો છે અને ઇમર્જિંગ એશિયાઈ કચ્છી તેમજ યુરોપિયન કચ્છીઓ પણ કડડબૂસ થઈ છે. ઓઈલ ટેન્કરોમાં ગલ્ફ-ચાઇના ફેઇટ પાંચ લાખ ડોલર વટી ગયા છે. સાઉથ અમેરિકા-ચાઇના, યુરોપ-ચાઇના ફેઇટ પણ

પલટાય તો 2020નું લોકડાઉન કે 2022 ચુદ્ધ વોર જેવું સપ્લાય ડિસરચાન આવ્યાના અંધાણ છે. ઈબદ રીઅલ એસ્ટેટ અને તેલીનીયામાં ટૂંકા ગાળામાં 15-25 ટકા તેજી થઈ છે. આ વચ્ચે અલ નીનોની આગાહી છે, ગરમીને કારણે પાછોતરા વાવેતરના ઘીનના ઉત્પાદન પર પ્રતિકૂળ અસરની વાત છે. સોયાબીન ખોટમથી 30 ટકા વધી ગયા છે. વિશ્વ બજારમાં સોયાતેલ, રાયડો, પામ પણ 10 ટકા ઝડપી વધ્યા છે. ભારતમાં ખરિફ સિઝન આડે બે-ત્રણ મહીના બાકી છે એ ખોતા

ચુદ્ધના માહોલમાં શેરબજાર ઘણુ ગગડ્યું હોવા છતાં ભારતીય શેરબજાર હજી એશિયામાં બીજા ક્રમનું મોંઘુ બજાર

પશ્ચિમ એશિયાના સંકટને કારણે શેરબજારમાં આવેલા ઘટાડાએ ભારતના વેલ્યુએશનને તેની ટોચ પરથી નીચે આણ્યું છે, તેમ છતાં એશિયન દેશોમાં ભારતીય શેરબજાર હજુ પણ બીજા ક્રમનું સૌથી મોંઘુ બજાર છે. ભારતીય શેરબજાર ઓવર વેલ્યુએશન ધરાવે છે તેવી ફરિયાદો વચ્ચે હાલ સારી વાત એ છે કે વેલ્યુએશનમાં ઘટાડો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ભારતના 50 શેરોના ઈન્ડેક્સ (નિફ્ટી 50)નું છેલ્લા 12 મહિનાનું ટ્રેલિંગ પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ (P/E) લગભગ 21.77x છે, જે તેના 5 વર્ષના સરેરાશ 23.7x અને 10 વર્ષના સરેરાશ 23.3x કરતા ઓછું છે. બેંકે, એશિયામાં માત્ર તાર્કિક વેલ્યુએશન 24.6x સાથે ભારત કરતા વધારે છે. ભારતનું P/E હજુ પણ ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ચીન (18.3x થી 19.7x)

ઇન્વેસ્ટમેન્ટ્સના ઈક્વિટી કો-હેડ ગૌરવ મિશ્રાએ જણાવ્યું હતું કે, ભારતીય બજારનું પ્રીમિયમ તેની ઐતિહાસિક રેન્જમાં નીચલા સ્તરે છે. કંપનીઓની બેલેન્સ શીટની ગુણવત્તા અને સિટર્ન ઓન ઈક્વિટી (RoE) ખોટા આ વેલ્યુએશન ગોચર છે. બેંકે, તેઓ ચિંતા વ્યક્ત કરે છે કે બે ચુદ્ધ લાંબુ ચાલશે, તો કોર્પોરેટ કમાણીમાં ઘટાડો થઈ શકે છે અને ત્યારે વેલ્યુએશનને અલગ સંદર્ભમાં જોવું પડશે. અલ્ટ્રાનીટિ ફિનેટેકના સહ-સ્થાપક અને ડિરેક્ટર યુ.આર. ભટ માને છે કે વેલ્યુએશનને સંબંધિત દેશના વ્યાજ દરો અને ઈન્ડેક્સની કમાણીમાં વૃદ્ધિના સંદર્ભમાં જોવું જોઈએ. જ્યાં સુધી આપણે આ પરિવર્તનોને ન જોઈએ ત્યાં સુધી ભારતની સરખામણી કોરિયા, ચીન કે અમેરિકા સાથે ન કરી શકાય. બે કમાણીમાં વૃદ્ધિ ઝડપી બને, તો વેલ્યુએશન વધુ સાડું દેખાશે. બજારમાં ચાલી રહેલા આ ઘટાડા વચ્ચે

એશિયામાં માત્ર તાર્કિક વેલ્યુએશન 24.6x સાથે ભારત કરતા વધારે છે, ભારતનું P/E હજુ પણ ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ચીન (18.3x થી 19.7x) કરતા ઊંચું છે

કરતા ઊંચું છે. ભારતનું ફોર્વર્ડ P/E પણ 18.19x છે, જે તેના 5 વર્ષના સરેરાશ 19.8x અને 10 વર્ષના સરેરાશ 18.9x કરતા ઓછું છે. આ બાબતમાં એશિયામાં માત્ર જાપાન 22.30x સાથે ભારત કરતા મોંઘું છે.

તેને હજુ પણ 'વાજબી' માને છે. કેપિટલ માર્ફેટ ગ્યુસ્તુઅલ ફંડના સીઈઓ ટીપક શિનોબ માને છે કે ભારતીય બજારનું વેલ્યુએશન તેજી કે મંદી બંને સ્થિતિમાં હંમેશા ઊંચું જ રહ્યું છે. મિટેને એસેટ ગ્લોબલ

ટ્રમ્પના નવા ફતવાથી ટ્રેડ ડીલ ફરી એકવાર ઘોંચમાં પડશે!!!

લાભ સમયથી ટેરિફ વોર ચાલી રહ્યું હતું, જે 2026ની શરૂઆતમાં વાટાઘાટોથી શાંત પડ્યું હતું અને અમેરિકા દ્વારા એક વચગાળાનું માળખું ફેબ્રુઆરી 2026માં જાહેર કરવામાં આવ્યું હતું. આ માળખું અંતિમ સ્વરૂપમાં આવે તે અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, તે દરમિયાન જીયો પોલીટીકલ ટેન્શન શરૂ થઈ જવા પામ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે તપાસની જાહેરાત કરી હોવાથી આ કોંક્રેટ ફરીથી ગૂંચવાઈ જવા પામ્યું છે. પરંતુ હજુ સુધી આ તપાસ સુધી વચગાળાનું માળખું ચાલુ રહેશે કે કેમ તે અંગે પ્રશ્નો છે.

બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર ચુદ્ધ કરી દીધું છે, તેથી વૈશ્વિક કુડની સમસ્યા સર્જાવાની સંભાવના છે, હોર્મુઝ સામુદ્રિય બંધ હોવાથી ખાડી દેશોમાંથી કુડની આયાત લગભગ બંધ થઈ ગઈ છે અને કુડના ભાવો ઉછળી રહ્યા છે, જે આ સ્થિતિ ચાલુ રહેશે તો કુડની અછત પણ સર્જાઈ શકે છે. ત્યારે આ ચુદ્ધ જો લાંબુ ચાલશે તો વૈશ્વિક મંદીની સંભાવના

આ પછી, ભારતે અમેરિકાને થતી આયાત પર ઓછા ટેરિફ ચુકવવા પડશે. વધુમાં, બંને દેશો વચ્ચે અત્યંત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, સૂત્રો હવે સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલી તપાસ બાદ તણાવ વધી ગયો હોવાથી, અમેરિકા કરાર પર હસ્તાક્ષર કરવામાં ઘણા મહિનાઓ સુધી વિલંબ કરી શકે છે. યુએસ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફને રદ કર્યાં. ત્યારથી, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર કોઈ વાતચીત થઈ નથી. દરમિયાન, અમેરિકાએ 16 વેપાર ભાગીદાર દેશોમાં તપાસનો આદેશ આપ્યો છે, જેમાં અમેરિકાને નુકસાન પહોંચાડતી અનૈતિક નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારત આ દેશોમાં સામેલ છે. તેથી, એવું માનવામાં આવે છે કે આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વેપાર કરાર આગળ વધશે નહીં.

અમેરિકા કોર્ટના ચુકાદા બાદ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સંદર્ભે ડોઈ વાતચીત થઈ નથી

અહેવાલો બહાર આવ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરાર પર હસ્તાક્ષર થવાની લગભગ આરે છે. ફેબ્રુઆરીમાં, બંને દેશોના નેતાઓ એક વચગાળાના માળખા પર પણ

માર્કેટ વોચ

ઓફ હોર્મુઝમાંથી પરિવહન બંધ કરી દેવાનું છે, જ્યાંથી 20 ટકાથી વધુ ઓઈલ અને ગેસના જહાજોનું પરિવહન થાય છે, જેના લીધે કુડ અને ગેસની અછત સર્જાવા લાગી

ઓફ-બીટ

જેમાં અમેરિકાને નુકસાન પહોંચાડતી અનૈતિક નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારત આ દેશોમાં સામેલ છે. તેથી, એવું માનવામાં આવે છે કે આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વેપાર કરાર આગળ વધશે નહીં.

ચુદ્ધથી શેરબજારમાં ખાનાખરાબી, પણ આવનારા દિવસોમાં મોંઘવારી રડાવશે

ઇરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના ચુદ્ધને બે સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે અને હજુ સુધી આ ચુદ્ધ વિરામ માટેની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. આ દરમિયાન વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેરબજારમાં પણ આ ચુદ્ધથી ખાનાખરાબી થઈ ગઈ છે. જેના લીધે રોકાણકારો ભાવચર જોવા મળી રહ્યા છે. આ ચુદ્ધ દરમિયાન ભારતીય શેરબજારમાં રોકાણકારોના આશરે 35 લાખ કરોડ રૂપિયા ડૂબી ચુક્યા છે, તે દર્શાવે છે કે, રોકાણકારો પૂબજ હતાશ થઈ ચુક્યા છે, જે નવા રોકાણ કરવાથી અડગા રહેતા જોવા મળી રહ્યા છે. જે રીતે સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર કડાકો

જોઈએ અને દરેક ઉછાળે નીકળતા રહેવું વધુ હિતાવહ સાબિત થશે. ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના ચુદ્ધમાં ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત થઈ ચુક્યું છે, એટલે અમેરિકા અને ઈઝરાયેલને આ ચુદ્ધ પુરું થવાનો આશાવાદ હતો, પરંતુ ઈરાનના નવા સુપ્રીમોની નિયુક્તિ થઈ ગઈ છે અને તેને ચુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, ખાસ કરીને સ્ટ્રેટ

જેના લીધે ભારત સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી વધી જવાની દહેશત સેવાઈ રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી માત્ર ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાના ચુદ્ધને હજુય બે સપ્તાહ જેટલો સમય થયો છે, પરંતુ કુડના ભાવો 119 ડોલરની સપાટીને ટચ કરી દીધા હતા અને હતા. જેના લીધે ભારત સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી વધી જવાની દહેશત સેવાઈ રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી માત્ર ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાના ચુદ્ધને હજુય બે સપ્તાહ જેટલો સમય થયો છે, પરંતુ કુડના ભાવો 119 ડોલરની સપાટીને ટચ કરી દીધા હતા અને ભારતનો ચુદ્ધમાં કોઈ રોલ નથી, છતાં મોટો આર્થિક ફટકો પડી શકે તેવી સંભાવના જોવાઈ રહી છે.